



Seat No. _____

HAK-16080001030200
B. Com. (Sem.-III) Examination
May - 2023
Economics
(Principles of Macro Economics-1)

Time : $2\frac{1}{2}$ Hours / Total Marks : 70

- 1 નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યોની વિગતવાર ચર્ચા કરો. 20
અથવા
1 નાણાંના પરિમાણાત્મક સિદ્ધાંતની વિગતવાર ચર્ચા કરો.
- 2 બેન્ક એટલે શું? બેંકના કાર્યો વર્ણવો. 20
અથવા
2 મધ્યસ્થ બેંક એટલે શું? મધ્યસ્થ બેંકના કાર્યો વર્ણવો.
- 3 કુલ અસરકારક માંગ એટલે શું? કુલ અસરકારક માંગને નક્કી કરતા પરિબળોની ચર્ચા કરો. 15
અથવા
3 વપરાશવૃત્તિનો અર્થ આપી વપરાશવૃત્તિને અસર કરતા પરિબળોની ચર્ચા કરો.
- 4 મૂડીની સીમાંત કાર્યક્ષમતાને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. 15
અથવા
4 કેઈન્સના રોજગારીના સિદ્ધાંતની ચર્ચા કરો.

ENGLISH VERSION

- 1 What do you mean by Money? Explain functions of money in detail. 20
- OR**
- 1 Discuss quantity theory of money in detail.

2 What is bank? Explain functions of banks. 20

OR

2 What is central bank? Explain functions of Reserve Bank of India.

3 What is aggregate demand? Explain determining factors of aggregate demand. 15

OR

3 Give meaning of propensity to consume. Discuss factors affecting propensity to consume.

4 Discuss factors affecting marginal efficiency of capital. 15

OR

4 Explain employment theory of Keynes.
